

કેનેડિયન પ્રોફેસરે IIT-Gn ખાતે હેલ્થનું નોલેજ શેર કર્યું



હેલ્થ ઈઝ વેલ્થ. માણસનું સ્વાસ્થ્ય સારું હશે તો એ કોઈ પણ વસ્તુ કરી શકે છે. આજની ભાગદોડ ભરી લાઈફમાં વિવિધ પ્રકારના હેલ્થને લગતા પ્રશ્નો માણસ સામે આવી રહ્યા છે. જેના પરિણામે માણસનું અપેક્ષિત આયુષ્યનો દર પણ ઘટી રહ્યો છે. જે બાબતને કેન્દ્રમાં રાખી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી), ગાંધીનગર ખાતે 'સમર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ' પર વન મંથનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડાની સાસ્કાટ્યેવન યુનિવર્સિટીના ૯ પ્રોફેસરે ભારતની વિવિધ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલા ૫૦ જેટલા સ્ટુડન્ટસને પબ્લિક હેલ્થની ટિપ્સ આપી હતી. જેમાં હેલ્થને લગતા ૧૦ જેટલા વિષયો પર સ્ટુડન્ટસને કેવી રીતે રિસર્ચ કરી શકાય. ગ્લોબલ હેલ્થમાં કેવા પ્રકારના ઈનોવેશન થઈ રહ્યા છે? જેવી વિવિધ બાબતોને લઈને એક્સપર્ટ ટોક યોજાયો હતો.

એક મહિના સુધીના આ પ્રોગ્રામમાં અંતે હેલ્થ એન્ડ ડેવલપમેન્ટને લગતા વિવિધ વિષયો પર સ્ટુડન્ટસને કેનેડાની યુનિવર્સિટી દ્વારા ખાસ પ્રપોઝલ આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટસને તેઓ હવે ગ્લોબલ હેલ્થ સિનારિયોને ધ્યાનમાં રાખી કેવા પ્રકારના રિસર્ચ ભવિષ્યમાં

**IIT-Gn ખાતે
કેનેડાની
સાસ્કાટ્યેવન
યુનિવર્સિટીના ૯ પ્રોફેસરે
ભારતની વિવિધ
ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલા
૫૦ જેટલા સ્ટુડન્ટસને
પબ્લિક હેલ્થની ટિપ્સ
આપી**

કરવા ઈચ્છી રહ્યા છે. તેના પર ભાવી તકો આપવામાં આવી હતી. જેને કેનેડાની આ યુનિવર્સિટી દ્વારા બુક્સના સ્વરૂપમાં ગ્લોબલ લેવલ પર પબ્લિશ કરવામાં આવશે.

આ અંગે આઈઆઈટીના બાયોલોજીકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ સંજય કુમાર કહે છે કે સમાજની હેલ્થની જરૂરિયાતો અને તેના સમાધાન આ ક્ષેત્રમાં રિસર્ચ કરીને જ સુધારી શકાય છે. જે બાબતની માહિતી મને આ ગ્લોબલ એક્સપર્ટ દ્વારા મળતા મને ખૂબ મદદરૂપ ભવિષ્યમાં થશે. એક મહિના ચાલેલા આ પ્રોગ્રામમાં ભારતની ખ્યાતનામ યુનિવર્સિટીઓના સ્ટુડન્ટસ હાજર રહીને હેલ્થનો ગ્લોબલ સિનારિયો જાણ્યો હતો.